



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૧/૦૩/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૭૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૩૫ કેસ કરી, ૧૧૨ વ્યક્તિઓને ઝડપી, ૪૨૭ લીટર દેશી દારૂ અને ૬ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૫ કેસ કરી ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૪,૭૬૯/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૭૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૫૭૮/૧૯

**સોલા હાઇકોર્ટ:** ગોપીબહેન દેવીલાલ પંચાલ (રહે.વંદેમાતરમ ટાઉનશીપ વિશ્વાસસીટી-૩ સામે ગોતા) તા.૩૦/૦૩/૧૯ સાજના ૫/૧૫ વાગ્યાના સુમારે ચાંદલોડીયા માધવઝાર્મ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) બે પુરૂષ ગોપીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લુંટ લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ગોપીબહેન પંચાલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

**સરદારનગર:** ગણપતભાઈ અર્જુનદાસ ચૌથાણી (ઉ.વ.૬૨)(રહે.જે.પી.પાર્ક સોસાયટી, પ્રેમપ્રકાશ આશ્રમ પાસે નોબલનગર રોડ) તા.૩૦/૦૩/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે સરદારનગર “જી” વોર્ડ સર્કલ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) બે પુરૂષ ગણપતભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- ખેચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ગણપતભાઈ ચૌથાણીએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.વી.ગોસાઇ ચલાવે છે.

**પાલડી:** વિરેન્દ્રકુમાર યુનીલાલ બગડીયા (ઉ.વ.૫૫)(રહે. સાગર સમ્રાટ ફ્લેટ જુના શારદા મંદીર રોડ એલીસબ્રીજ) તા.૨૯/૦૩/૧૯ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે અંજંત ફ્લેટ, જૈનનગર, નવા શારદા મંદીર રોડ નજીકથી વિરેન્દ્રકુમાર પત્ની સાથે એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરૂષ વિરેન્દ્રકુમારની પત્નીના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ વિરેન્દ્રકુમાર બગડીયાએ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એમ.રાહોડ ચલાવે છે.

ત્યજી દીઘેલ બાળક બાબત:-

સમાચાર યાદી નં.૫૭૯/૧૯

શાહીબાગ: તા.૨૯/૩/૧૯ કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે શાહીબાગ સિવિલ હોસ્પિટલ NACU વોર્ડ ખાતે કાંતીભાઈ મીણા અને જીવાલી મીણા (બંને રહે.જ્યોતિભંડા તા.ધમલો જી.ડુંગરપુર રાજસ્થાન) નામનું દંપતી આઠ દિવસના બાળક (બેબી) ને સારવાર દરમ્યાન હોસ્પિટલમાં બીનવારસી ત્યજી જતું રહ્યું છે. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એ.વાઘેલા ચલાવે છે.

દાણીલીમડા: તા.૩૦/૩/૧૯ કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે દાણીલીમડા રામરહિમનો ટેકરો ઐયુબ કિરાણા સ્ટોરની પાછળ ગલીમાં તાજુ જન્મેલું બાળક (બાબો) ત્યજી દીઘેલ હાલતમાં મળી આવતા દાણીલીમડા પોલીસે અજાણી વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધી આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એસ.ગોહિલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૮૦/૧૯

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: દીપુ સન/ઓફ રામસખા રાવત (ઉ.વ.૨૧) (રહે. ગ્યાસપુર અમદાવાદ) ગ્યાસપુર ખાતે નદીના પટમાં જે.સી.બી.ના હેલ્પર તેરીકે કામ કરતો હતો, તા.૩૦/૩/૧૯ કલાક ૩/૩૦ વાગ્યાના સુમારે પટમાં સુતો હતો ત્યારે રેતી ભરવા આવેલ ડમ્પર નંબર જીજી ૦૧ સીવાય ૯૨૨૨ ના ચાલકે ડમ્પર રીવર્સ લેતા ડમ્પર દીપુ રાવત ઉપર ચઢી જતા ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનાર દીપુ રાવતના ભાઈ રાકેશ રાવતે “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.વાઘેલા ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૮૧/૧૯

શાહીબાગ: નિતિનભાઈ નટવરલાલ ત્રિવેદી (ઉ.વ.૪૪) (રહે. નીલકંઠ રો-હાઉસ હરસિદ્ધિ પાર્ક પાછળ વસ્ત્રાલ) તા.૨૭/૩/૧૯ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે શાહીબાગ મોહન સિનેમા પાસે વિનય એલ્યુમિનિયમ નામની કાચની દુકાનમાં કામ કરતા હતા ત્યારે નિતિનભાઈને ગળાના ભાગે કાચ વાગતા શાહીબાગ ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી અજીતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,

કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.

પોલીસ કમિશનર વતી.